

## પિતાના વારસદારો

— જસવંત મહેતા

નૃષણના પુત્ર કણ્વમુનિને દેવો, માનવીઓ, ગાંધર્વો, મરુતો... બધા જ “મા ધરતીના બાળ” તરીકે પ્રકૃતિની ગોદમાં રાતદિન રમતા અવધૂત તરીકે જ ઓળખતા.

નૈમિષારણ્યનાં વનાંચલોમાં દિવસે હરતાં—ફરતાં, વેદોની ઋચાઓથી સમગ્ર વાતાવરણને એમના કોમળ કંઠે વર્ણવી સંગીતમય બનાવી દેતા. એમના ચહેરા પર શિશુસુલભ હાસ્ય સદાય વિલસતું રહેતું. નાનાં ગામડાંઓ, નેસડાઓ, કૂબાઓમાં વસતાં ભલાંભોલાંણાં માનવબાળો વચ્ચે બેસીને મંડળીઓ જમાવતા. વેદની ઋચાઓ, સૂક્તો અને ગાંધર્વના ગાનનું પઠન કરતા રહે અને સાંજ પડ્યે એમની ગુફામાં આવી જાય.

નાનાં નાનાં ગામડાંઓથી થોડાક અંતરે ભયાનક જંગલ હતું. રાની પશુઓની ત્રાદથી એ ગાજતું રહેતું. એ જંગલમાં એક મોટા મોટા દાંતવાળો, વિકરાળ ચહેરાવાળો બક નામનો રાક્ષસ થોડા સમયથી રહેવા આવ્યો હતો. સવાર પડ્યે “માણસ ગંધાય માણસ ખાઉ” ની ગર્જના કરતો એના શિકાર માટે આજુબાજુનાં ખેતરોમાં, ગામડાંઓમાં ફરી વળતો અને જે કોઈ હાથમાં આવે અને “સ્વાહા” કરતો લોકોમાં ભય પેદા કરતો ભટક્યા કરતો. ભોળા ગ્રામવાસીઓ રાક્ષસની રંજાદથી ત્રાસી ગયા હતા, પરંતુ એમનો સામનો કરવાની એમનામાં છિમત નહોતી. પ્રજા લાચાર હતી. અનેક ગામડાંઓ રાક્ષસના ત્રાસથી ઉજ્જવલ થઈ ગયાં. અનેક ગામલોકો ગામ છોડી દૂર દૂર ચાલ્યા ગયા હતા.

બક રાક્ષસની ભયંકર વાતો કણ્વऋષિને ગામના લોકો ડરતાં ડરતાં કહેતા. ઋષિના ચહેરા પર વાતો સાંભળી ડરની રેખાઓ ઊપસી નહોતી. એ તો એમની મસ્તીમાં વનની આજુબાજુના વિસ્તારમાં ઘૂમ્યા કરતા.

એક વખત આ રીતે ફરતાં ફરતાં એ નિર્જન વનમાં બકના રહેઠાણ પાસે આવી ચડ્યા. કાળમીઠ પથ્થરોથી કંડારાયેલી ગુફામાં ભરબપોરે બક નસકોરાં બોલાવતો ઊંઘતો હતો. એની પુત્રી આંગણામાં રમતી હતી. દૂરથી મસ્તીમાં જૂમતા વેદગાન ગાતા — મોજથી એના રહેઠાણ તરફ આવી રહેલા લાંબી જટા અને દાઢીવાળા વલ્કલ પરિધાન કરેલા ઋષિને આવતા જોઈ બકની દીકરી ગભરાઈને એની તરફ દોડી ગઈ.

બિલકુલ ભયરહિત, આવી મસ્તીમાં ડોલતા બિન્દાસ માણસને એણો આ પહેલાં એના વિસ્તારમાં ક્યારેય આવતો જોયો નહોતો. એના રાક્ષસ પિતાથી ઉરીને, ભાગ્યે જ આ ઘેઘૂર વનમાં જનપદનો માણસ આવતો. અને કદાચ રસ્તો ભૂલીને આવી ચડ્યો હોય તો એનો રાક્ષસ પિતા બક એનો કોળિયો કરી જતો.

રાક્ષસ કન્યા દોડીને ઋષિ પાસે પહોંચી ગઈ અને હાંઝતા સ્વરે બોલી ઉઠી :

“અરે... તમે તો કોઈ અલગારી તપસ્વી લાગે છો. કઈ બાજુ વિહાર કરવા નીકળી પડ્યા છો ? આ ઘેઘૂર વનમાં ભૂલા તો નથી પડ્યાને? તમને ખબર છે આ ગુફામાં કોણ રહે છે ?”

કણવઋષિ હાંઝતી કોમળ કળી શી કન્યાના પ્રશ્નો સાંભળી નાના બાળકની જેમ ખડખડાટ હસી પડ્યા અને ધીમેથી બોલી ઉઠ્યા :

“દેવી... આ બક રાક્ષસનું જ નિવાસસ્થાન છે ને ? હું ભૂલતો ન હોઉં તો તમે જ એનાં સુપુત્રી છો ને ? હું એને મળવા આવ્યો છું.”

જવાબમાં રાક્ષસકન્યા ખડખડાટ હસી પડી. ઋષિ પણ એના જેવા જ નિર્દોષ... બાળ સમા સ્વભાવના હતા.

“ઋષિરાજ... આપનું અનુમાન સાચું છે. મારા પિતા બક અહીં જ રહે છે અને હું એમની પુત્રી છું. ઋષિવર્ય... મારા પિતાને તમે મળવાની હિંમત તો કરી છે, પરંતુ એ તો તમને જોતાં જ એમનાં વિશાળ જડબાં ખોલી, એમના વજ જેવી હાથની મુક્કીમાં તમને ઊંચકીને ઓહિયાં જ કરી જશે. માણસ—માત્ર એમના ભક્ષ હોય છે. માણસને એ ક્યારે જીવતો મૂક્તા નથી.” — રાક્ષસકન્યા સહજ ચિંતિત સ્વરે બોલી.

“ખરેખર ?” કણવઋષિએ આશ્વર્ય વ્યક્ત કરતાં કહ્યું.

“હા... ઋષિવર્ય... તમારા જેવા ભોળા સંતને આ રીતે જોતાં મારું હદ્ય ફફડી ઉઠે છે. તમને કેવી રીતે બચાવવા એની જ મથામણમાં હું છું. તમે મારું માનો તો આ સામેની ગુફામાં તમને સંતાડી દઉં. થોડા સમયમાં જ મારા પિતા જાગશે અને એમના ભક્ષ માટે ગામ ભણી પ્રવાસ આદરશે કે તરત જ હું તમને બહાર કાઢી મુખ્ય માર્ગ પર મૂકી જઈશ.”

“હું બકને મળવા આવ્યો છું. મારે એની સામે કોઈ દુશ્મની નથી. હું તો મૈત્રી કરવા આવ્યો છું. તમે એને મારા આગમનની ખબર આપો.”



ऋषिनી નિર્ભય વાળી સાંભળી રાક્ષસકન્યા વિચારમાં પડી ગઈ.

“આ તે કેવો ઋષિ છે ! કાંઈ સમજતો જ નથી. પિતાજ જાગી જશે તો કેવો અનર્થ થશે એનું એને ભાન નથી. આ ઋષિ મરવાનો થયો છે.” – રાક્ષસ કન્યા મનોમન બોલી ઉઠી. એને યુવાન કણુવઋષિની દ્વારા આવતી હતી. આ માનવીને મૃત્યુનો ડર નહોતો એનું એને આશ્વર્ય હતું. રાક્ષસ કન્યા જોતી રહી. ઋષિ એની બાજુમાંથી સરકતા બક સુતો હતો એ ગુફામાં પ્રવેશ્યા. રાક્ષસકન્યા ડરની મારી ધૂળ ઉઠી.

“મિત્ર બક, હું ઋષિ કણુવ....તમારી સાથે મૈત્રી કરવા તમારા આંગણો આવ્યો છું, તમને મળવા આવ્યો છું.”

ऋષિના મધુર શર્ઝો કાને પડતાં જ બક સફાળો જાગી ગયો. આંખો સામે વલ્લલઘારી ઋષિને જોઈ એને આશ્વર્ય થયું. એ કશુંક બોલવા જાય ત્યાં તો....

“અરે ભાઈ, મારી સામે શું જોઈ રહ્યો છે? બક, હું તારો મિત્ર કણુવ છું – મને ન ઓળખ્યો ? આપણી તો દોસ્તી જન્મજન્માતરની છે, બંધુ ! ભવાટવીના ચક્કરમાં ભટક્યા કરવાનું આપણા

નસીબમાં જ લખ્યું છે. જોને, તું રાક્ષસયોનિમાં. હું મનુષ્યયોનિમાં, પણ આપણાં ચક્કરો ઓછાં જ થતાં નથી.” કણવત્તૃષ્ટિ બોલ્યા. બક વિચારમાં પડી ગયો. ઘડીભર તો એ ઋષિની મધુર વાણીના પ્રવાહમાં તણાઈ ગયો. આવી મીઠી—મધુર વાણી આ પહેલાં એણે ક્યારેય સાંભળી નહોતી, જેમાંથી પ્રેમની વર્ષા વરસી હોય. એ ખુદ એટલો કૂર હતો કે સૌ કોઈ એનાથી ડરીને વાત કરતા.

“ઋષિવર્ય....હું તમને ઓળખતો નથી, પરંતુ તમારી નિર્ભય, મૂઢુ, પ્રેમાળ વાણીથી તમારા પ્રત્યેનો અહોભાવ મારા મનમાં જાગ્રત થયો છે. તમે મિત્ર બનવા આતુર છો એવું મેં મારી જિંદગીમાં પહેલી વાર સાંભળ્યું છે. હું તમારી મૈત્રીભાવનાનું સ્વાગત કરું છું....આપના આગમનનું પ્રયોજન સાદર કરો. આજ્ઞા કરો, મારે શું કરવાનું છે?”

“આજ્ઞા ? બંધુ ! હું આજ્ઞા કરવા નહીં, તમારી સાથે મૈત્રી બાંધવા આવ્યો છું. તમારી પાસે બળ છે, મારી પાસે બુદ્ધિ છે. બળ અને બુદ્ધિનો સંયોગ જન-હિતાય જનસુખાય થાય એવી આશા સાથે હું અહીં આવ્યો છું.”

“મહારાજ, તમારી માગણી અને મારામાં મૂકેલી શ્રક્ષાએ મને ભાવવિભોર બનાવી દીધો છે. મૈત્રી કરવાનું અમારા જેવા અસુરોના સ્વભાવમાં જ નથી. મારા હાથે હજારો માણસોની હત્યા થઈ છે. રાક્ષસયોનિમાં જન્મેલો હું અને પવિત્ર ઋષિઓની કુળપરંપરામાં જન્મેલા તમે, આપણો મેળ ‘સ્વભાવ’ની દૃષ્ટિએ કેમ જામશે ?”

“ભાઈ બક, તમે રાક્ષસ છો.....તમારી કોઈ ખાસ યોનિ છે એવું વિચારતા જ અટકી જાઓ. તમે.....હું આપણે સૌ મૂળ તો માનવજીતના વંશજ છીએ. ઋષિ, રાક્ષસ આ બધી તો આપણી પોતાની ઘડેલી ભેદરેખાઓ સ્વભાવગત દોરાઈ ગઈ છે અને એ પણ આપણી પોતાની મનઘડંત માન્યતા પ્રમાણે છે. આપણે સૌ કોઈ જગન્નિયંતાના દીવેલા બાળકો છીએ. તમારા માંયલામાં છુપાયેલા શુભ સંસ્કારોને, તમારી વિચારધારાને જગાડો. તમારું આ પાશવી જીવન સુધરીને પુણ્યાત્મા બની જશો.” ક્યારેય ન સાંભળેલી વાણી સાંભળતાં બક રાક્ષસ વિચારમાં પડી ગયો : ક્યાંક મનુષ્યજીતિની આ કોઈ એને ફસાવવાની જાળ તો નથીને ?

“ઋષિ, તમે આવી અંતરને સ્પર્શી જાય, આત્મરામને જગાડી દે તેવી વાતો કરી મને ફસાવવા તો નથી આવ્યાને ? તમને અહીં કોણે મોકલ્યા છે ? તમારા મનમાં મારા જેવા માટે આવો સહદ્યી ભાવ કેમ જાગ્યો ?”

“આ બધા પ્રશ્નોના સાચા ઉત્તરો તો તમને તમારા વર્તન પરથી જ મળી જાય છે.”

“‘બોલો, તમારે મૈત્રી કરવી જ હોય તો મારું એક કાર્ય કરવું પડશે.’’

“‘જરૂર. તમારું કામ કરી દેવામાં મને શો વાંધો હોય?’’

‘‘ઋષિ, મારી આ પુત્રી છે ને ખૂબ જ સરળ અને ભાવુક છે, ભલી અને ભોળી છે. એ બિચારી આ જંગલમાં વસતા ઋષિમુનિઓને વંદન કરવા જાય છે, તો એનો રાક્ષસપુત્રી તરીકે તિરસ્કાર કરે છે. બિચારી રડતી રડતી પાછી ફરે છે. મને ધણો ગુસ્સો એ ઋષિમુનિઓ પર આવે છે. એમના જેવા પવિત્ર આત્માઓએ તો પ્રેમથી મારી દીકરીને નવાજવી જોઈએ. તમે મારી પુત્રી સાથે લગ્ન કરશો? તમે એના દુઃખી હૃદયને સાંત્વન આપશો? માણસની જાત પ્રત્યે એને તિરસ્કાર જાગે અને એ પણ રાક્ષસીવૃત્તિ ધારણ કરી કાળો કેર વરતાવે એ પહેલાં મારી એ ઋજુ હૃદયની દીકરીને તમે પરણીને એને સંસ્કારી, ધર્મિષ્ઠ, પવિત્ર બનાવો.

વાત સાંભળી ઋષિ વિચારમાં પડી ગયા. બકની વાત સાચી છે. ઋષિમુનિઓ જેવા સંસ્કારી ધર્મિકજનો પણ શીલ સૌંદર્ય અને વિવેકથી છલકાતી નિર્દોષ કન્યાને – એ રાક્ષસપુત્રી હોવાથી અપનાવવા – એમનો વાત્સલ્યપ્રેમ આપવા તૈયાર નહોતા અને હડધૂત કરતા હતા અને વિશ્વમાં નફરત અને ધિક્કારના વિષની વાવણી કરી રહ્યા હતા. ક્ષણ પૂરતો વિચાર કરીને ઋષિએ જગતમાં સુખશાંતિનું સામ્રાજ્ય છવાઈ જાય અને પિતામાં રહેલી માનવજાત પ્રત્યેની નફરતની આગ શમી જાય એ ખાતર પણ રાક્ષસ કન્યા સાથે લગ્ન કરવાનો નિર્ણય લેતાં કહ્યું :

“‘તમારી પુત્રી સાથે હું લગ્ન કરીશ.’’

“‘હા, પણ એક શરત છે. મારી એકની એક પુત્રીનાં લગ્ન પછી તમારે અહીં રહેવું પડશે.’’

“‘કુમ—કુમ?’’ ઋષિ ઉછલતા સ્વરે બોલી ઉઠ્યા.

“‘કારણ કે તમે અહીં રહી અમને સંસ્કારિતાનાં શાસ્ત્રો ભણાવશો.’’ ઋષિએ લગ્ન માટે હા પાડી અને જનપદ છોડી રાક્ષસો વચ્ચે રહેવા માંડ્યાં. બકની પુત્રીને પણ આ સાધુ મહાત્મા ગમી ગયા હતા. બન્નેનાં લગ્ન થયાં. એમને બે પુત્રો થયા. એક જ માતાપિતાના સંતાનો હોવા હતાં બન્નેના સ્વભાવમાં ધણો મોટો ફરક હતો. તેમનાં નામ હતાં ત્રિશોક અને નાભાક. ત્રિશોકમાં મોસાળના તામસી સ્વભાવના ગુણ ઉત્ત્યા. એ ખૂબ જ બળવાન હતો. નાભાક એ રીતે પ્રમાણમાં સારો હતો.

કણવમુનિએ લોકોનું કલ્યાણ કરવા માટે સંસાર માંડ્યો. એમનું કાર્ય પૂર્ણ થતાં એ ઘરસંસાર છોડી એમની મસ્ત અલગારી રીત પ્રમાણે જિંદગી જીવવા, સાર્થક કરવા પાછા એમની પ્રિય ગુફામાં તપ્ય કરવા ચાલ્યા ગયા.

સરસ્વતી નદીના કિનારે નાભાકે એક નાનકડી જૂંપડીમાં રહેવાનું શરૂ કર્યું. નાભાકની માતા અને એના “‘નાના’” પણ પરલોક સિધાવ્યાં. પરંતુ મોસાળમાં વધુ સમય વ્યતીત કરતા ત્રિશોકે એના નાનાનો વારસો જાળવી રાખવા લૂંટફાટ, હત્યા ઈત્યાદિ કરવા માંડયાં. લોકો ત્રાસી ગયા.

“‘ભાઈ ત્રિશોક.’” – એક વખત નાભાકે ત્રિશોકને આંગણે આવી કહ્યું.

“શું છે ?”

“‘ભાઈ ત્રિશોક, જાગો ! ઘણું સૂતા.’” એ જ પિતાની મધુર વાણી બોલી રહ્યો હતો.

“કોણ, મોટાભાઈ નાભાક ? તમે ક્યાંથી ?”

“‘ભાઈ, વર્ષો પહેલાં આપણી માતાના રાક્ષસ પિતા આમ જ એક બપોરે સૂતા હતા અને પિતાએ એમને જગાડ્યા હતા અને પિતાની મધુરવાણીથી એમનો ‘માંયલો’ જાગી ગયો અને સ્વભાવમાં પરિવર્તન આવી ગયું.’”

“‘મોટાભાઈ....સ્વભાવ તો માણસ મૃત્યુ પામે તોપણ બદલાતો નથી હોતો. બાકી આપણા પિતાએ કશાક જાદુ-ટોણા કર્યા હશે તેથી નાનાજીની રાક્ષસીવૃત્તિમાં પરિવર્તન આવી ગયું. મારે એવો સ્વભાવ બદલવો નથી. તમે સંત-કક્ષાના માણસ છો – તો તમે માનવસમાજના હિતાર્થે સત્કાર્યો કરતા રહો. મારી ચિંતા મારા પર છોડી દો.’” ત્રિશોક બોલ્યો.

“‘ત્રિશોક...આ જનપદના મહાનાનાના પુત્ર ઉઠીને આવું બોલે છે એ શોભતું નથી.’”

“‘મોટા ભાઈ, તમે પિતાના પગલે ચાલો. હું તો મારા નાનાના પગલે ચાલી આજુબાજુ ત્રાહિમામ પોકરાવી દઈશ.’”

“‘અરે ભાઈ, તું કોનું સંતાન છો ! કેવા પવિત્ર વાતાવરણમાં તે જન્મ લીધો ! અને આજે તું અસૂર કાર્યો કરી રહ્યો છે એ બરોબર નથી..’”

“‘મોટાભાઈ...મારે શું કરવાનું છે ?’” ત્રિલોકે મોટાભાઈની આમન્યા રાખતાં પૂછ્યું.

“‘બસ, પિતાનો વારસો સંભાળ અને અજવાળ.. અને જનપદ તેમજ વનાંચલની પ્રજામાંથી તારા નામની ભીતિ કાઢી નાખી સુખી, પવિત્ર જીવન ગાળીશ તો તારો જન્મારો સુધરી જશે અને પિતાની આબરૂ વધશે.’”

– અને મંત્રદ્રષ્ટા નાભાક ઋષિએ પિતાનાં સત્કાર્યોનું તર્પણ કરતાં નાનાભાઈના તામસી સ્વભાવમાં પરિવર્તન આણી ત્રિશોકને ઋષિ બનાવ્યો.

